

AC-134

April-2023

B.Ed., Sem.-IV**D-03 : Environmental Education****Time : 2:30 Hours]****[Max. Marks :****1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :**

- (A) પર્યાવરણ શિક્ષણના સિદ્ધાંતો સમજવો.
 (B) નિવસનતંત્રના ઘટકો જણાવો.

અથવા

- (A) પર્યાવરણનો અર્થ આપો. તેની સંકલ્પના ઉદાહરણ સાથે સમજવો.
 (B) સમજવો : જીવાવરણ અને મીઠા પાણીનું નિવસનતંત્ર.

2. નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- (A) પુનઃપ્રાપ્ય સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરશો ?
 (B) હવા પ્રદૂષણનો અર્થ આપો. તેની હાનિકારક અસરો સમજવો.

અથવા

- (A) પ્રાકૃતિક સંસાધનોનો અર્થ આપો. તેના સંરક્ષણ અને વ્યવસ્થાપન વિશે જણાવો.
 (B) જળ પ્રદૂષણ એટલે શું ? જળ પ્રદૂષણ ફેલાવાના કારણો અને ઉપાયો સમજવો.

3. નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- (A) જંગલોનું મહત્વ જણાવી, વન આચારન ઘટવાથી ઊભી થતી સમસ્યાઓ જણાવો.
 (B) લુપ્ત થતી પ્રજાતિઓનું સંરક્ષણ સમજવો.

અથવા

- (A) જૈવ વિવિધતા એટલે શું ? વિવિધ ગ્રોઝેક્ટોની જૈવ વિવિધતા પર અસરો સમજવો.
 (B) સમજવો : સ્વચ્છ ભારત અભિયાન.

4. નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- (A) પેરિસ કરાર 2015 – સમજવો.
 (B) NCF 2005 અંતર્ગત પર્યાવરણ શિક્ષણ અંગેની ભલામણો જણાવો.

અથવા

- (A) સમૂહ માધ્યમોનો ફાળો સમજવો.
 (B) પર્યાવરણ શિક્ષણના વિવિધ અભિગમોની ચર્ચા કરો.

5. નીચેનામાંથી કોઈપણ સાત પ્રશ્નોના જવાબ આપો :
- (1) વન્યજીવ સૂચિનું મહત્વ સ્પષ્ટ કરો.
 - (2) જીવાવરણ એટલે શું ?
 - (3) ભૂમિ પ્રદૂષણને અટકાવવાના કોઈપણ ચાર ઉપાયો આપો.
 - (4) કુત્રિમ નિવસનતંત્ર એટલે શું ? ઉદાહરણ આપો.
 - (5) ઈકોટુરીઝમ એટલે શું ?
 - (6) પર્યાવરણ શિક્ષણના કોઈપણ બે હેતુઓ આપો.
 - (7) બિન પરંપરાગત ઊર્જા સ્લોટ એટલે શું ? ઉદાહરણ આપો.
 - (8) રેડટેટા બુક એટલે શું ?
 - (9) વિશ્વવન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 - (10) ગુજરાતના પક્ષી અભયારણ્યો જણાવો.
 - (11) નૈસર્જિક સ્લોટો એટલે શું ? ઉદાહરણ આપો.
 - (12) પર્યાવરણ શિક્ષણ માટે ઉપયોગી કોઈપણ ચાર સામયિકોના નામ જણાવો.

AC-134

April-2023

B.Ed., Sem.-IV**D-03 : Environmental Education****Time : 2:30 Hours]****[Max. Marks : 70]**

1. Answer the following question :

- (A) Explain the principles of Environmental Education. 7
 (B) State the components of Ecosystem. 7

OR

- (A) Give the meaning of Environment. Explain its concept with example. 7
 (B) Explain : Biosphere and Fresh water Ecosystem. 7

2. Answer the following questions :

- (A) How do you conserve renewable Resources ? 7
 (B) Give the meaning of Air Pollution. Explain its harmful effects. 7

OR

- (A) Give Meaning of Natural Resources. Explain about its conservation and management. 7
 (B) What is Water Pollution ? Explain the causes and remedies of Water Pollution. 7

3. Answer the following questions :

- (A) Explain Importance of forests and state the problems arising due to loss of forest cover. 7
 (B) Explain conservation of endangered species. 7

OR

- (A) What is Biodiversity ? Explain the impacts of various projects on Biodiversity. 7
 (B) Explain : Clean India Movement. 7

4. Answer the following question :

- (A) Explain : Paris Agreement 2015. 7
 (B) State the recommendations on Environmental Education under NCF 2005. 7

OR

- (A) Explain the contribution of Mass Media. 7
 (B) Discuss about the different approaches of Environmental Education. 7

5. Answer any of the following 7 questions :

- (1) Explain the importance of wildlife.
- (2) What is Biosphere ?
- (3) Give any four measures to prevent land pollution.
- (4) What is Artificial Ecosystem ? Give an example.
- (5) What is Ecotourism ?
- (6) Give any two objectives of Environmental Education.
- (7) What is non-conventional Energy source ? Give an example.
- (8) What is Red Data Book ?
- (9) When is World Forest Day celebrated ?
- (10) State the bird sanctuaries of Gujarat.
- (11) What are Natural resources ? Give an example.
- (12) Name any four periodicals useful for Environmental Education.